



ક્રમાંક/B.K.N.M.U./N.S.S./76/2026

તા. 20/06/2026

વિષય – આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૬ (IDY-2026) ની ઉજવણીના ભાગરૂપે My Bharat Portal પરની ડીજિટલ પ્રવૃત્તિઓમાં યુવા ભાગીદારી સુનિશ્ચિત કરવા બાબત.

પરિપત્ર :-

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન એન.એસ.એસ. યુનિટ ધરાવતી તમામ કોલેજોના આચાર્યશ્રીઓ તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરને ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૬ (IDY-2026) ની ઉજવણીના ભાગરૂપે My Bharat દ્વારા My Bharat Portal પર યુવા ભાગીદારી અને જનસમુદાયને જોડવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે અનેક ડીજિટલ પ્રવૃત્તિઓ શરૂ કરી છે, તેથી NSS પ્રોગ્રામ ઓફિસરોએ NSS યુનિટ, સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની નીચે દર્શાવેલ ડીજિટલ પ્રવૃત્તિઓમાં મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.

1. 21 Days, 21 Minutes Reel Challenge (૨૧ દિવસ, ૨૧ મિનીટ રીલ સ્પર્ધા)

https://mybharat.gov.in/pages/event_detail?event_name=21-Minutes-21-Days-International-Yoga-Day-2026&key=900160494900

2. Yoga Selfie Contest (CCRYN) (યોગ સેલ્ફી સ્પર્ધા)

https://mybharat.gov.in/pages/event_detail?event_name=Selfie-in-Yoga-Session&key=418161787418

3. International Day of Yoga 2026 Mega Event (આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ મુખ્ય કાર્યક્રમ)

https://mybharat.gov.in/mega_events/international-day-of-yoga-2026

4. IDY 2026 Quiz Challenge by Morarji Desai National Institute of Yoga (MDNIY)

(મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ યોગ (MDNIY) દ્વારા IDY-૨૦૨૬ પ્રશ્નોત્તરી સ્પર્ધા)

https://mybharat.gov.in/quiz/quiz_dashboard/dmwvc21BcVJLQkhaSzdVYWRJZmpEQTO9

આથી યુનિવર્સિટી સંલગ્ન તમામ પ્રોગ્રામ ઓફિસરને જણાવવામાં આવે છે કે આ પ્રવૃત્તિઓને વધુ અગ્રીમતા આપવી અને યુનિટના કાર્યક્ષેત્ર હેઠળ આ પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ યુવા જોડાણ અને ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દૈનિક પ્રયાસો કરવા. વધુમાં, આ અંગેનો ફોટોગ્રામ સહિતનો અહેવાલ અત્રે યુનિવર્સિટી, NSS વિભાગ ખાતે ઈ-મેઈલ – nss@bknmu.edu.in પર મોકલી આપવાના રહેશે.

પ્રો. કો- ઓર્ડીનેટરશ્રી,
એન.એસ.એસ. વિભાગ
BKNMU – જુનાગઢ

નકલ રવાના જાણ અર્થે :-

- રાજ્ય એન.એસ.એસ. અધિકારીશ્રી, ગાંધીનગર તરફ
- રીજીયોનલ ડાયરેક્ટરશ્રી, એન.એસ.એસ. ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ તરફ
- માન. કુલપતિશ્રી/ કુલસચિવશ્રી ના અંગત સચિવશ્રી તરફ

